




શ્રી નરેન્દ્ર મોદી

માનનીય વડાપ્રધાન

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

માનનીય મુખ્યમંત્રી, ગુજરાત



ઉત્તર ગુજરાત

(મહેસાણા)






ભવ્ય ઉદ્ઘાટન

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

માનનીય મુખ્યમંત્રી, ગુજરાતના

પરદ્વેસ્તે

ગરિમાથી ઉપસ્થિતિ

શ્રી અશ્વિની વૈષ્ણવ

માનનીય કેન્દ્રીય મંત્રી, રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી, ભારત

9 ઓક્ટોબર 2025, ગુરુવાર સવારે 09:45 વાગે ગણપત યુનિવર્સિટી, મહેસાણા, ગુજરાત

ઉત્તર ગુજરાતની ક્ષમતાઓ

ઉદ્યોગ

- ગુજરાતના મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 5% યોગદાન
- સમર્પિત ફેક્ટ કોરિડોર અને DMIC (મહેસાણા, પાટણ, બનાસકાંઠા) અને MBSIR (મહેસાણા)ની હાજરી

હસ્તકલા

- પાટણ - પટોળાં સાડીઓ અને ચૂક ભરતકામ માટે પ્રખ્યાત (GI ટેગ-બનાસકાંઠા)

કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા

- ભારતમાં ઇસબગુલ પ્રોસેસિંગમાં 90% હિસ્સો
- ગુજરાતમાં બટાકાનું સૌથી વધુ (78%) ઉત્પાદન (બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી)
- એશિયાની સૌથી મોટી સહકારી ડેરી - બનાસ ડેરી, સાથે સાબર ડેરી અને દૂધસાગર ડેરીની ઉપસ્થિતિ
- એશિયાનું સૌથી મોટું મરી-મસાલા બજાર ઊંઝા, મહેસાણામાં

પ્રવાસન

- આધ્યાત્મિક, વારસો, સરહદ-પર્યટનની ઉપલબ્ધતા

કેન્દ્રિત ક્ષેત્રો



કૃષિ, ડેરી અને ખાદ્ય પ્રક્રિયા



ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ



કૌશલ્ય વિકાસ



ઓટો અને ઓટો કોમ્પોનન્ટ્સ



એન્જિનિયરિંગ



પ્રવાસન અને સંસ્કૃતિ



સ્ટાર્ટઅપ્સ



MSMEs

કોન્ફરન્સની વિશેષતાઓ

- ઉદ્ઘાટન સમારોહ
- સેક્ટર-સ્પેસિફિક સેમિનાર
- રાષ્ટ્રવ્યાપી સેમિનાર
- પેનલ ચર્ચાઓ
- સીઈઓ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ
- વર્કશોપ એન્ડ ક્વિઝ
- B2B / B2G મીટિંગ્સ
- વિશેષ પ્રવાસ
- ઔદ્યોગિક ક્ષેત્રોની મુલાકાત
- પ્રાદેશિક પુરસ્કારો (MSMEs/કારીગર-કસબી)

- પ્રાદેશિક MSME કોન્ફલેવ
- ટ્રેડ શો/પ્રદર્શન
- રિવર્સ બાયર-સેલર મીટિંગ
- ઉદ્યમી મેળો
- રાજ્ય સેમિનાર્સ
- વિકેતા વિકાસ કાર્યક્રમ
- સાંસ્કૃતિક કાર્યક્રમ
- સમાપન સત્ર

શેલો ચો: vibrantgujarat vibrantgujarat vibrant_gujarat vibrantgujarat

INDEXTB
INDUSTRIAL EXTENSION BUREAU
(A GOVT. OF GUJARAT ORGANISATION)

બ્લોક નંબર 18, બીજો માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર 11, ગાંધીનગર 382 010 (ગુજરાત) ભારત | ફોન: + 91-79-2325 6009, 2325 0492/93 | www.indextb.com
વેબસાઈટ: www.vibrantgujarat.com | ઇમેઈલ: vibrantgujarat.gov.in | હેલ્પલાઈન (+91 79 2324 000) હેલ્પલાઈન સંચાલનના દિવસ અને સમય: સોમવારથી શુક્રવાર, સવારે 11:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી

ભાગીદાર સંસ્થા

icbc

INDO-CANADIAN BUSINESS CHAMBER

JEIRO

US-INDIA

ભાગીદાર દેશ

જાપાન

દક્ષિણ કોરિયા

વિયેતનામ

વેબસાઈટ પર પહોંચવા માટે સ્કેન કરો



લોકેશન પર પહોંચવા માટે સ્કેન કરો



adani


અમે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય
વિમાનમથકનું ઉદ્ઘાટન કરવા બદલ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો
હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

આ લક્ષ્યને 8 ઓક્ટોબર, 2025 ના રોજ સાકાર કરવામાં અમને માર્ગદર્શન અને સમર્થન કરવા બદલ અમે
મહારાષ્ટ્ર સરકાર અને જનતા સહિત અમારા તમામ ભાગીદારો અને ટીમ્સના આભારી છીએ. અદાણી ગ્રુપ મહારાષ્ટ્ર
અને આપણા રાષ્ટ્રની આ વિકાસ યાત્રામાં ભાગ બનવાનો ગર્વ અનુભવે છે.

ભારતની પ્રેરણા. દુનિયાની પ્રશંસા.



In Fond Remembrance



PADMA VIBHUSHAN
MR. RATAN N TATA
28.12.1937 - 09.10.2024

The lessons you taught us in humility,
purpose and generosity will forever stay with us.



TATA SONS & TATA GROUP OF COMPANIES

યુકેના પીએમ સ્ટાર્મરે મુંબઈમાં YRF સ્ટુડિયોની મુલાકાત લીધી, ફિલ્મ સહયોગને ગાઢ બનાવવાનો આગ્રહ કર્યો

મુંબઈ: યુનાઈટેડ કિંગડમના વડા પ્રધાન કીર સ્ટાર્મરે બુધવારે અંધેરીમાં યશ રાજ ફિલ્મ્સ (વાયઆરએફ) સ્ટુડિયોની મુલાકાત લીધી અને જાહેરાત કરી કે વાયઆરએફ સહિત મુખ્ય ભારતીય પ્રોડક્શન હાઉસ યુકેમાં વિવિધ સ્થળોએ ફિલ્મો બનાવશે.

યુકેના વડા પ્રધાન, ભારતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. તેમની સાથે બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ, બ્રિટિશ ફિલ્મ કમિશન, પાઈનવુડ સ્ટુડિયો, એલ્સ્ટ્રી સ્ટુડિયો અને સિવિલ સ્ટુડિયોના પ્રતિનિધિઓ સહિત તેમના દેશના ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધિમંડળ પણ છે.

તેઓ YRFના સીઈઓ અક્ષય વિધાની, YRFના ચેરપર્સન આદિત્ય ચોપરાની અભિનેત્રી પત્ની રાની મુખર્જી, મેડોક ફિલ્મ્સના દિનેશ વિજન, એક્સેલ એન્ટરટેઈનમેન્ટના રિતેશ સિંઘવાની અને ધર્મા પ્રોડક્શનનાં અપૂર્વા મહેતા સહિતના અનેક ભારતીય નિર્માતાઓને મળ્યા હતા.

“બોલિવૂડ બ્રિટનમાં પાછું ફર્યું છે, અને તે નોકરીઓ, રોકાણ અને તકો લાવી રહ્યું છે. આ બધું જ યુકેને વૈશ્વિક ફિલ્મ નિર્માણ માટે વિશ્વ કક્ષાના સ્થળ તરીકે પ્રદર્શિત કરે છે. ભારત સાથેનો વેપાર કરાર આ પ્રકારની ભાગીદારી માટે નિર્ધારિત છે જે વિકાસને વેગ આપશે, સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવશે અને દેશભરના સમુદાયો માટે સેવા આપશે,” યુકેના વડા પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું.

સ્ટાર્મર અને ભારતીય નિર્માતાઓ વચ્ચેની બેઠક લગભગ ૩૦ થી ૪૦ મિનિટ સુધી ચાલી હતી, એમ એક સૂત્રએ જણાવ્યું હતું.

YRFના CEO અક્ષય વિધાનીએ કહ્યું કે તેઓ યુકેના વડા પ્રધાનનું સ્વાગત કરીને સન્માનિત થયા છે. “યુકે અમારા હૃદયમાં ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે અને ‘દિલવાલે દુલહનિયા લે જાયેંગે’ (DDLJ) સહિતની અમારી કેટલીક સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મોનું શૂટિંગ આ સુંદર અને અતિ આતિથ્યશીલ દેશમાં થયું છે.

આજે YRF ખાતે યુકેના વડા પ્રધાન કીર સ્ટાર્મરને આ

પ્રિસ્કિપ્શન અને બિલમાં છેતરપિંડી નાગપુરની કંપનીના મેડિકલ ઓફિસર વિરુદ્ધ કેસ નોંધાયો

નાગપુર: વેસ્ટર્ન કોલકિલ્ડસ લિમિટેડ (ડબ્લ્યુસીએલ)ની ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર સહિત બે વ્યક્તિ વિરુદ્ધ બનાવટી પ્રિસ્કિપ્શન અને બિલ બનાવવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હોવાની જાણકારી સંબંધિત અધિકારીઓએ બુધવારે આપી હતી. સીબીઆઈની એન્ટી કરપ્શન બ્રાન્ચ (એસીબી) એ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.પૃથ્વી કૃષ્ણ પટ્ટા અને મેડિકલ દુકાનના માલિક કમલેશ એન લાલવાણી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે તેમને ૧૭ સપ્ટેમ્બરે ડોક્ટર પટ્ટા વિરુદ્ધ ફરિયાદ મળી હતી. ફરિયાદમાં આરોપ મુકવામાં આવ્યો હતો કે તે મેડિકલ પ્રિસ્કિપ્શન બનાવટી છે, જેના આધારે લાલવાણી મોટી રકમના બિલ બનાવી રહ્યા હતા. આ માહિતીના આધારે કાર્યવાહી કરતા સીબીઆઈની બે ટીમએ ડબલ્યુસીએલના વિજિલન્સ વિભાગના અધિકારીઓ સાથે મળીને નાગપુરમાં ડબલ્યુસીએલના મેડિકલ વિભાગ અને ડિસ્પેન્સરીમાં સાથે મળી અચાનક તપાસ હાથ ધરી હતી. નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું કે આ વર્ષે ૧૫ એપ્રિલના પત્ર દ્વારા, લાલવાણીએ યુકવર્ણી માટે તબીબી પ્રિસ્કિપ્શન સાથે માર્ચ ૨૦૨૫ના બિલ રજૂ કર્યા હતા. ચકાસણી પ્રક્રિયા દરમિયાન જાણવા મળ્યું હતું કે ડો. પટ્ટાએ તેમના હસ્તાક્ષરમાં મૂળ પ્રિસ્કિપ્શનમાં મોંઘી દવાઓમાં નામ ઉમેર્યો હતા, જ્યારે દવાખાનામાં રાખવામાં આવેલી કોપીમાં આ દવાઓનો કોઈ ઉલ્લેખ નથી. (પીટીઆઈ)■

બીડી સળગાવી એક વ્યક્તિએ ઢોળાયેલા પેટ્રોલ પર દિવાસળી ફેંકી, છ દાઝ્યા

નાશિક: મહારાષ્ટ્રના નાશિકમાં બુધવારે બીડી સળગાવ્યા પછી એક વ્યક્તિએ અજાણતામાં ઢોળાયેલા પેટ્રોલ પર માચીસ ફેંકી દેતાં છ લોકો દાઝી ગયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. કેટલાક ઘાયલોને જિલ્લા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકોને ખાતગી તબીબી સુવિધામાં સારવાર આપવામાં આવી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અકસ્માત શહેરના સાતપુર વિસ્તારમાં બપોરના સમયે થયો હતો. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મહાદેવવાડીના મટન માર્કેટ પાસે એક ઝાડ કાપવાનું કામ કેટલાક કામદારોને

ફેશન

ખુશ્બુ મુલાણી કક્કર

feedback.ladki@bombaysamachar.com

ગોલ્ડન ઘાઘરો - મલ્ટિપલ ચુઝ



દરેક મહિલાઓ પાસે ગોલ્ડન કલરનો ઘાઘરો હોવો જ જોઈએ. એક ગોલ્ડન ઘાઘરો તમારા ઘણા પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે અને ફેસ્ટીવ વેર માટે તો બેસ્ટ ઓપ્શન છે. ગોલ્ડન કલરનો ઘાઘરો ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતો નથી, શર્ત માત્ર એટલી જ કે તમને મિક્સ એન્ડ મેચ કરતા આવડવું જોઈએ. નાની બાળકીથી લઈને મોટી ઉંમરની મહિલાઓ પણ આ ગોલ્ડન કલરનો ઘાઘરો પહેરી શકે છે. ગોલ્ડન કલરમાં ઘણા શેડ્સ આવે છે. તમે તમારા સ્કીન ટોન મુજબ ગોલ્ડન શેડની પસંદગી કરી શકો. ખાસ ધ્યાન એ રાખવું કે, તમારી પાસે જે કપડાં હોય તેને મેચિંગ ગોલ્ડન શેડ લેવો જેથી કરી આસાનીથી મિક્સ એન્ડ મેચ કરી શકાય. ચાલો જાણીએ ગોલ્ડન ઘાઘરો કઈ કઈ રીતે મિક્સ એન્ડ મેચ કરી તહેવારમાં સુંદર લાગી શકાય.

ઘાઘરો અને કુર્તી - ઘાઘરા સાથે કુર્તી એક ગ્રેસફુલ લુક આપે છે. તમે તમારી ઊંચાઈ મુજબ કુર્તીની લેન્થની પસંદગી કરી શકો. તમારી પાસે જો કોઈ રાણી કલરની કુર્તી હોય અને તેની પર ગોટા વર્ક હોય કે પછી જરદોશી વર્ક કરેલું હોય તો તેની સાથે ગોલ્ડન ઘાઘરો પહેરી શકાય. ગોલ્ડન ઘાઘરા સાથે મોટા ભાગે બધા જ કલર સારા લાગે છે પરંતુ જો બને ત્યાં સુધી ખુલતા કલર જ પહેરવા. એટલે કે, રાણી, ગ્રીન, રેડ, મરૂન, રોયલ બ્લુ વગેરે. જો તમારી હાઈટ સારો હોય અને સુગ્રોળ શરીર હોય તો તમે શોર્ટ લેન્થ એટલે કે ગોકણ સુધીની લંબાઈવાળી કુર્તી પણ પહેરી શકો.

કુર્તીમાં વર્ક હોય કે ન હોય, ડાર્ક કલરની કુર્તી ગોલ્ડન ઘાઘરા સાથે સારી જ લાગશે. હાફ લેન્થની કુર્તી ગોલ્ડન ઘાઘરા સાથે પહેરવાથી ઘાઘરો ઘણો ખરો દેંકાઈ જશે. આ માટે કુર્તીની જે સાઈડસ્લિટ હોય તેમાં કલરફુલ ટસલ્સ લગાડી શકાય. આ લુક સાથે દુપટ્ટો પહેરવો કે નહિ તે તમારી પર્સનલ ચોઈસ છે. જો તમે આ લુક સાથે દુપટ્ટો પહેરવાનો હોવ તો અલગ પ્રકારના ટ્રેપીંગ આવડવા જોઈએ જેથી અલગ અલગ લુક આપી શકાય.

ઘાઘરાચોળી - ઘાઘરા અને ચોળી એ દરેક


મહિલાઓનો એક ફેવરિટ ડ્રેસ હોય છે. ગોલ્ડન કલર સાથે મોટા ભાગના કલર મિક્સ એન્ડ મેચ કરી શકાય છે. તમે તમારી ઊંચાઈ અને બોડી ટાઇપ મુજબ કઈ લેન્થનું બ્લાઉઝ પહેરવું છે તે તમે નક્કી કરી શકો. જેમ કે જો તમારી ઊંચાઈ સારી હોય તો તમે કમર સુધીનું બ્લાઉઝ પહેરી શકો કે જેમાં ડિન્સેસ કટ આવેલી હોય કે જેથી આખો દુપટ્ટો તમે ફન્ટમાં ઢાંકો નહિ તો ખરાબ ન લાગે. ખાસ એ ધ્યાનમાં રાખવું કે, આ લુક સુગ્રોળ શરીર ધરાવતી મહિલા કે યુવતી પહેરી શકે કે પછી જેમનું શરીર વધારે છે તેઓ તેમનું પેટ અને કમરને ઢાંકવા પહેરી શકો. ગોલ્ડન ઘાઘરા સાથે રેઝ્યુલર બ્લાઉઝ કરતા ફેન્સી બ્લાઉઝ વધારે સારા લાગશે એટલે કે બેકલેસ, હોલ્ટર નેક વગેરે. આ લુક સાથે ખુલ્લો દુપટ્ટો વધારે સારો લાગશે. જો તમારે સૌથી સેફ કોમ્બિનેશન પહેરવું હોય તો ગોલ્ડન ઘાઘરા સાથે મરૂન અને બ્લેક કલરનું સિલ્કનું બ્લાઉઝ પહેરી શકાય. બ્લેક અને મરૂન કલરના બ્લાઉઝ પર જો ગોલ્ડન થ્રેડ વર્ક હશે તો પણ સારું લાગશે.

ઘાઘરા સાથે ફેન્સી ટોપ- ગોલ્ડન ઘાઘરા સાથે ફેન્સ ટોપ ખૂબ જ સુંદર લાગે છે . ફેન્સી ટોપ એટલે કે પેપ્લમ ટોપ કે પછી કોપ ટોપ. પેપ્લમ ટોપ એટલે જે ટોપમાં ચોક હોય અને પછી ફલેર હોય. ફેરનો ઘેરો સ્ટીલ પર આધાર રાખે છે. ફલેરમાં પણ બે પ્રકાર હોય છે જેમકે, કાળી વાળો ફલેર કે પછી ચુન વાળો ફલેર . જો તમારે ફોર્મલ લુક જોઈતો હોય તો, કલીવાળા પેપ્લમ ટોપ પહેરવા. કલીવાળા ટોપ પહેરવાથી એક ફોર્મલ લુક આવે છે. પેપ્લમ ટોપ પહેર્યા પછી એક ફેન્સી લુક આવે છે. અને યંગ યુવતીઓ પર આ પેટર્ન વધારે સારી લાગે છે. કોપ ટોપ એટલે કે જેની લંબાઈ રેઝ્યુલર ટોપ કરતા ઓછી હોય અથવા તો ગોલ્ડન ઘાઘરા સાથે શોર્ટ કાફતાન પણ સુંદર લાગશે. વધારે ફેન્સી લુક આપવા માટે એસીમેટ્રીકલ ઇમ્બેઇનવાળું કાફતન પણ પહેરી શકાય. અથવા તો ઓફ શોલ્ડર ટોપ પહેરી શકાય કે જેમાં બસ્ત લાઈન પર કોલર આપવામાં આવ્યો હોય. ફરથી લેયરવાળું ટોપ જ લાગશે. આ લુક સાથે મીનીમલ જ્વેલરી લુક સારો લાગશે. વાળમાં સોફ્ટ કર્લ્સ પણ સારા લાગી શકે.

ગોલ્ડન ઘાઘરા સાથે જેટલું સિમ્પલે મિક્સ એન્ડ મેચ હશે તેટલું જ સુંદર લાગશે. ગોલ્ડન ઘાઘરો જ એક ઇમ્પ્રેસિવ લુક આપે છે. કોઈનું આંધળું અનુકરણ કરવું નહીં.. જે તમને સારું લાગે અને તમારી પાસે જે હોય તેમાં જ મિક્સ એન્ડ મેચ કરવું.

પુરુષનાં શરીરમાં અટવાઈ ગયેલી સ્ત્રીની વ્યથા...

એ બંધનમાંથી મુક્તિ કઈ રીતે મેળવી એ સુધીની સફળતાની કહાણી



વિશેષ

રાજેશ યાજ્ઞિક

feedback.ladki@bombaysamachar.com

ઓળખ અને વ્યક્તિત્વ પરની ચર્ચાઓ વચ્ચે, તાજેતરના દાયકાઓમાં લિંગ ઓળખનો પ્રશ્ન ખૂબ ચર્ચામાં રહ્યો છે. અત્યારે સજાતીય સંબંધ અને ટ્રાન્સજેન્ડરનો કાનૂની સ્વીકાર થાય તે માટે લડાઈ ચાલી રહી છે. ટ્રાન્સજેન્ડર એટલે જે વ્યક્તિ શારીરિક રીતે સ્ત્રી કે પુરુષ છે, પણ તેમના મનની લાગણીઓ અને આંતરિક ભાવ તેનાથી વિપરીત છે. આ લાગણી જેટલી તે અનુભવનાર માટે સમજવી અને સ્વીકારવી મુશ્કેલ છે તેટલી જ તેમના પરિવાર અને સમાજ માટે. તેમાંથી જ એક માનસિક અને સામાજિક સંઘર્ષ ઊભો થાય છે. કેટલાક આ સંઘર્ષનો સામનો કરવામાં હારી જાય છે. તેમનું જીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે. તો કેટલાક પોતાના આ આંતરિક સંઘર્ષને માત આપીને સમાજ સામે બંડ પોકારીને પોતે જેવા છે તેનો સ્વીકાર કરીને નવા જીવનની કેડી કંડારે છે.

આજે એક એવી ટ્રાન્સજેન્ડર નૈના મેનનની વાત કરવી છે, જે પુરુષના ખોળિયામાં સ્ત્રીનો આત્મા લઈને જન્મી. નૈનાએ પોતાનો પુરુષ તરીકેનો ભૂતકાળ લગભગ ભૂંસી જ નાખ્યો છે એટલે આપણે તેને નૈના જ કહીશું. તેનો જન્મ કેરળમાં થયો હતો. પણ તેનું શિક્ષણ દિલ્હીમાં થયું હતું. નૈનાને તેના શાળાનાં વર્ષો દરમિયાન ખ્યાલ આવ્યો કે તે શાળાના અન્ય છોકરાઓ કરતા અલગ હતી, નૈનાને સ્ત્રીઓ જેવા પોશાક પહેરવાનું ખૂબ ગમતું. તેના શોખ છોકરા જેવા નહોતા આનાથી તે ભાવનાત્મક રીતે અશાંત થઈ ગઈ. સૌથી મોટી સમસ્યા એ હતી કે તેની પાસે પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે કોઈ નહોતું. આવું કેમ બની રહ્યું છે તે તેને પોતાને સમજાતું નહોતું. આ સમય તેના માટે પોતાની ઓળખ અંગે મૂંઝવણનો હતો જે સમજવો તેમના માટે સરળ નહોતો.

પુરુષ તરીકે જન્મેલી નૈનાને સમય જતાં તેનાં છુપાયેલાં સ્ત્રીત્વનો અહેસાસ થયો. જ્યારે નૈનાએ બેંગલુરુમાં કોલેજમાં પ્રવેશ મેળવ્યો, ત્યારે તેને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી કે તે એકલી નથી. તેનાં જેવાં ઘણાં લોકો લિંગ ઓળખના મુદ્દાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. તેની ઈચ્છા પાછલી એવી જોઈએ, કારણ કે તે હાઇડ્રેટિંગ એજન્ટ છે. આ કુદરતી વસ્તુઓથી માલિશ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.

આંખ નીચે ડાર્ક સર્કલ માટે શું છે વધુ અસરકારક?



ડાર્ક સર્કલની સમસ્યા



નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશન મુજબ, ઇન્ફ્રાઓર્બિટલ એરિયા એટલે કે આંખોની ત્વચા (આંખના સોકેટ હેકળની ત્વચા)માં કાળાશ પડવી, આંખોની આસપાસ ફોલ્લીઓ અથવા કાળાશ પડવા ક્યારેક મેલાનિનના સંચયને કારણે થઈ શકે છે. આ ઉપરાંત જ્યારે ત્વચા તેની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે, ત્યારે તે એક પડછાયો બનાવે છે જેના પર પ્રકાશ પડતાં કાળાશ પડવા લાગે છે. પેરીઓર્બિટલ એડીમા, પોસ્ટ-ઇન્ફ્લેમેટરી હાઇપરપીગમેન્ટેશન જેવા કારણોસર પણ કાળાશ પડવા લાગે છે.

આ કુદરતી વસ્તુઓ ઉપયોગી થઈ શકે છે

નિષ્પ્રભાત કહે છે કે જ્યારે ડાર્ક સર્કલ માટે ઘરેલુ ઉપચારની વાત આવે છે, ત્યારે હાઇડ્રેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમારે ઘી, ફુલ મિલ્ક ક્રીમ, ગ્લિસરીન, મધ, દહીં જેવી વસ્તુઓ લેવી જોઈએ, કારણ કે તે હાઇડ્રેટિંગ એજન્ટ છે. આ કુદરતી વસ્તુઓથી માલિશ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.

આંખ નીચે પેચ અથવા ક્રીમ

ડાર્ક સર્કલ અટકાવવા માટે આંખના પેચનો ઉપયોગ કરવાનું ચલાણ ઘણું વધી ગયું છે. કોસ્મેટિક સર્જનના કહેવા મુજબ આંખો નીચે અથવા આસપાસ કાળાશ પડવાથી બચવા અથવા તેનાથી છુટકારો મેળવવા માટે હાઇડ્રેશન (પાણી અને સ્વસ્થ પીણાં પીતા રહેવું) ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને વ્યક્તિએ પોષક તત્વોથી ભરપૂર આહાર પણ લેવો જોઈએ. ત્વચાને હાઇડ્રેટ કરવા માટે, મોઇસ્ચરાઇઝર લગાવવું જોઈએ અને પછી ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ગોળ ગતિમાં હળવા હાથે માલિશ કરવી જોઈએ. વાસ્તવમાં ત્વચાને ભેજ મળવાની સાથે, તે રક્ત પરિભ્રમણને પણ ઝડપી બનાવે છે, જે તમને ઝડપી ફાયદા આપી શકે છે. આંખો નીચે પેચ લગાવવાથી તાત્કાલિક પરિણામો મળે છે, જ્યારે ક્રીમથી માલિશ કરવાથી લાંબા ગાળાના ફાયદા થાય છે.

નિખાર

દિક્ષિતા મકવાણા

feedback.ladki@bombaysamachar.com

ડાર્ક સર્કલની સમસ્યા પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે. તેનાથી છુટકારો મેળવવા માટે, સોશ્યલ મીડિયા પર ઘણા હેક્સ મળી શકે છે. ક્રીમ ઉપરાંત, ડાર્ક સર્કલ ટાળવા માટે આંખના પેચ પણ ખૂબ ટ્રેન્ડમાં છે. અહીં આપણે જાણીશું કે બેમાંથી કયું વધુ અસરકારક છે.

આંખો નીચે ડાર્ક સર્કલ ચહેરાનું વૃદ્ધત્વ દર્શાવે છે, પરંતુ તે કોઈપણ ઉંમરે અને કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. આધુનિક જીવનશૈલી એવી છે કે ખૂબ જ નાની ઉંમરે પણ ડાર્ક સર્કલ હોવું એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. હકીકતમાં સરળ શબ્દોમાં કહીએ તો, આંખો નીચે અથવા તેની આસપાસ ડાર્ક સર્કલ બનવા પાછળનાં મુખ્ય કારણો એટલે લાંબા સમય સુધી સ્કીન સામે સમય વિતાવવો, રાત્રે યોગ્ય રીતે ન સૂવું, ખૂબ તણાવમાં રહેવું, અયોગ્ય આહારને કારણે પોષક તત્વોનો અભાવ હોઈ શકે છે. કેટલાક લોકોમાં, તે આનુવંશિક પણ હોઈ શકે છે. ડાર્ક સર્કલ ટાળવા માટે, પેચ અથવા અંડર આઈ ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ બેમાંથી કયું શ્રેષ્ઠ અથવા વધુ અસરકારક છે.

ડાર્ક સર્કલને કારણે, ચહેરાની સુંદરતા ઓછી થતી નથી, પરંતુ વ્યક્તિ થાકેલા અને બીમાર દેખાવા લાગે છે. તે આત્મવિશ્વાસને પણ અસર કરવાનું શરૂ કરે છે. ડાર્ક સર્કલને રોકવા અને ઘટાડવા માટે, દરરોજ સારી ઊંઘ લેવી સૌથી મહત્વપૂર્ણ છે, પરંતુ આ ઊંઘ યોગ્ય સમયે લેવી પણ અગત્યનું છે. આ ઉપરાંત સંતુલિત આહાર, હાઇડ્રેશન (પાણી પીવું) અને આંખોની આસપાસની ત્વચાની યોગ્ય કાળજી જરૂરી છે. ચાલો જાણીએ કે આંખો નીચે પેચ લગાવવું વધુ સારું છે કે ક્રીમ.





સેક્સ્ટોર્શન:

જ્યારે ન્યૂડ વીડિયો કોલ બ્લેકમેલિંગમાં ફેરવાય જાય...

મેલ મેટર્સ

અંકિત દેસાઈ

feedback@bombaysamachar.com

આજના ડિજિટલ યુગમાં, ઇન્ટરનેટ અને સોશલ મીડિયાએ જ્યાં લોકો વચ્ચેના અંતર ઘટાડ્યા છે ત્યાં સાયબર ક્રાઈમ (સાયબર અપરાધ)ના નવાં જોખમો પણ ઊભાં કર્યાં છે. આ જોખમોમાંનું એક સૌથી ચિંતાજનક સ્વરૂપ છે સેક્સ્ટોર્શન (Sextortion) અથવા ન્યૂડ વીડિયો કોલ બ્લેકમેલિંગ. આ ગુનામાં, ગુનેગારો સામાન્ય રીતે સોશલ મીડિયા પ્લેટફોર્મ્સ અથવા રેટિંગ એપ્સ દ્વારા પુરુષને ફસાવે છે, તેમની સાથે વિશ્વાસ કેળવે છે અને પછી વીડિયો કોલ દરમિયાન તેમને અશ્લીલ કૃત્યો કરવા માટે મનાવે-લલચાવે છે, જેના રેકોર્ડિંગનો ઉપયોગ પાછળથી પૈસા પડાવવા માટે કરવામાં આવે છે. આ પ્રકારના બ્લેકમેલિંગનો ભોગ બનેલા પુરુષ ઘણીવાર શરમ, ડર અને એકલતાને કારણે ચૂપ રહે છે, જે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે.

આ આખી જાળ ખૂબ જ ચાલાકીથી ગોઠવવામાં આવે છે. ગુનેગારો, જેઓ મોટે ભાગે આંતરરાષ્ટ્રીય ગેંગનો ભાગ હોય છે, એ આકર્ષક પ્રોફાઇલ ફોટાનો ઉપયોગ કરે છે, મોટે ભાગે કોઈ સ્ત્રીનો. ઝડપથી વિશ્વાસ કેળવવા માટે એ પ્રેમ કે સંબંધના ખોટા વાદા કરે છે. એકવાર પીડિત (પુરુષ) ફસાઈ જાય, પછી પેલા પુરુષને વીડિયો કોલ માટે પૂછે છે.

કોલ શરૂ થતાં જ, ગુનેગાર (અથવા ઘણીવાર ગુનેગાર દ્વારા ઉપયોગમાં લેવાતી વ્યક્તિ) કપડાં ઉતારવાનું અથવા અશ્લીલ કૃત્ય કરવાનું શરૂ કરે છે અને સામે છેડે પુરુષને પણ તેવું કરવા માટે લલચાવે છે. આ વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ ગુનેગાર દ્વારા ગુપ્ત રીતે કરવામાં આવે છે. કોલ પૂરો થતાં જ, પીડિતને તે વીડિયો મોકલવામાં આવે છે અને તેની પાસેથી જબરદસ્તીથી મોટી રકમની માગણી કરવામાં આવે છે, ધમકી આપવામાં આવે છે કે જો પૈસા નહીં આપે તો આ વીડિયો તેના પરિવાર, મિત્રો કે સોશલ મીડિયા પર શેર કરી દેવામાં આવશે.

જો કોઈ પુરુષ આ પ્રકારના બ્લેકમેલિંગનો શિકાર બને તો સૌથી પહેલું અને મહત્વનું પગલું છે ગભરાટમાં આવવાને બદલે શાંત રહેવું. બ્લેકમેલરનો મુખ્ય હેતુ ડર પેદા કરીને પૈસા પડાવવાનો છે અને આ રીતે ગભરાટમાં લેવાયેલો નિર્ણય તમને આર્થિક અને માનસિક રીતે વધુ નુકસાન પહોંચાડી શકે છે.

પૈસા ચૂકવશો નહીં: બ્લેકમેલરને ક્યારેય પૈસા ચૂકવવા જોઈએ નહીં. મોટાભાગના કિસ્સાઓમાં, એકવાર તમે પૈસા ચૂકવશો, પછી એ ગેન્ગ વધુ પૈસાની માગણી કરવાનું ચાલુ જ રાખશે. પૈસા ચૂકવવાથી તમે માત્ર તેમની ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપો છો.

તુરંત તમામ સંચાર બંધ કરો: બ્લેકમેલિંગનો મેસેજ આવતાં જ તે વ્યક્તિને બધા જ સોશલ મીડિયા પ્લેટફોર્મ્સ, વોટ્સએપ અને અન્ય સંચાર માધ્યમો પરથી તુરંત બ્લોક કરી દો. બ્લેકમેલર સાથે વાતચીત સંપૂર્ણપણે બંધ કરી દો. તેમને કોઈ જવાબ આપશો નહીં, દલીલ કરશો નહીં કે ધમકીઓ આપશો નહીં. પુરાવા એકઠા કરો: બ્લોક કરતાં પહેલાં, ધમકીભર્યા મેસેજિસ, વીડિયો

કોલના સ્ક્રીનશોટ, પ્રોફાઇલ ID (યુઝરનેમ), અને ચેટ હિસ્ટરીના પુરાવા એકઠા કરીને સુરક્ષિત જગ્યાએ સાચવી લો. આ પુરાવા ભવિષ્યમાં પોલીસ ફરિયાદ માટે અત્યંત મહત્વના છે.

પોલીસનો સંપર્ક કરો: આ કાયદેસરનો ગુનો છે, અને તેનાથી ડરવાની કે શરમાવાની જરૂર નથી. તમારા નજીકના પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઈમ સેલ, અથવા ઓનલાઈન પોર્ટલ પર જઈને તુરંત ફરિયાદ નોંધાવો. પોલીસ અધિકારી આવા કેસોથી વાકેફ હોય છે અને તમારી ઓળખ ગુપ્ત રાખીને કાર્યવાહી કરશે. ફરિયાદ નોંધાવવી એ ગુનેગારોને પકડવા અને અન્ય લોકોને બચાવવા માટેનું એક મહત્વનું પગલું છે.

પરિવાર અને મિત્રો સાથે વાત કરો: પુરુષો ઘણીવાર શરમ અને ગૌરવને કારણે આ વાત છુપાવે છે, જે તેમને વધુ માનસિક તણાવ આપે છે. એક વિશ્વાસુ મિત્ર, જીવનસાથી કે પરિવારના સભ્ય સાથે વાત કરવાથી માનસિક બોજ હળવો થાય છે અને તમને સહકાર મળે છે.

તમારા એકાઉન્ટ્સ સુરક્ષિત કરો: તમારા બધા સોશલ મીડિયા એકાઉન્ટ્સની પ્રાઇવસી સેટિંગ્સને ઠીક કરવા અને અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ કે મેસેજ સ્વીકારવાનું ટાળો.

યાદ રાખો, સેક્સ્ટોર્શનનો ભોગ બનવું એ તમારી ભૂલ નથી, પરંતુ ગુનેગારનો ગુનો છે. સમયસર કાર્યવાહી, મૌન તોડીને મદદ માગવી અને કાયદેસરની પ્રક્રિયા અપનાવવાથી આ જોખમી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે. આ પ્રકારના પડકારનો સામનો કરતી વખતે મજબૂત રહેવું અને પોતાને માનસિક રીતે તંદુરસ્ત રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું એ જ સાચી હિંમત છે. ■



જીવન સંઘ્યાએ સંઘ્યા-છાયાનો અનુભવ કરવો હોય તો વધતી ઉંમર સાથે પોતે પોતાની જાતમાં બદલાવ લાવવો જરૂરી છે. પરિવર્તન સમયની માગ છે. સમય સાથે પરિવર્તન જરૂરી છે. આપણાં સમયમાં જેવો માહોલ હતો તેવો માહોલ અત્યારે ન જ હોય. આપણાં વડીલોને પણ એવું જ લાગતું હતું કે જમાનો બદલાઈ ગયો છે, અમારે જૂની આંખે નવા તમાશા જોવાના છે. જે વાત આપણાં વડીલો કરતા હતા તે જ વાત આજે આપણે કરી રહ્યા છીએ. આજની પેઢીની રહેણીકરણી જોઈને આપણને પણ જૂની આંખે નવા તમાશા જોતા હોઈએ એવું લાગે છે. જો કે એ બધાં સાથે વૃદ્ધાવસ્થામાં એડજસ્ટ થવું જરૂરી છે. જો એડજસ્ટ ન થઈએ તો પછી વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવે. વૃદ્ધો જો પોતાનો જ કક્કો ખરો કરવાની જીદ પકડી રાખે તો કોઈ સામે પણ નહીં જુએ. આજની પેઢીને એ વડીલો 'ડસ્ટબીન' જેવાં લાગવા માંડશે..


આવી જીવનની ઢળતી સાંજે જો થોડીક સાવધાની રાખીને વર્તન કરવામાં આવે તો સંતાનોના દિલમાં જગા બનાવીને જીવન સંઘ્યાએ પણ શીળા છાંયડાનો અનુભવ કરી શકાય. આ માટે કેટલીક વાતો ધ્યાનમાં

રાખવી જરૂરી છે. આવો, વિચારીએ શું કરવું જોઈએ? ઉંમર થાય એટલે બોલવાનું ઓછું કરી નાખવાનું. આખો દિવસ બડબડ નહીં કરવાનું. ભૂલી વશમાં રાખવાની. આજની પેઢી એટલી વ્યસ્ત અને સ્ટ્રેસ છે કે ઘરમાં જો વડીલો કારણ વગર વાતો કર્યા કરે તો એમને બડબડ કરતા હોય તેવું લાગે છે. તેથી જરૂર પડતું જ બોલવું. મૌન સૌથી ઉત્તમ.

ઘણી વાર ઘરના વડીલ એકની એક વાત રિપીટ કરતા હોય છે. એમના જીવનની ઘટના વારંવાર સંભળાવતા હોય છે ત્યારે પરિવારના સભ્યો ત્રાસી જાય છે. વડીલને યાદ ન હોય કે આ વાત તો એલરેડી ઘણીવાર કહી દીધી છે તેથી મૌન ધારણ કરી લેવું. મૌન રહેવાથી બીજાને તો સારું લાગશે જ પણ પોતાની જાતને ય સારું લાગશે.

ઉંમર વધતા પોતાની જરૂરિયાતો ઓછી કરી નાખવી જોઈએ. બહુ મર્યાદિત ચીજ-વસ્તુથી ચલાવતા શીખી જવાનું. 'મને આમ તો જોઈશે અને તેમ પણ જોઈશે...' એવું બધું ચાલવાનું નથી. તમારી જાતજાતની જરૂરિયાતો પૂર્ણ કરવાનો સમય કોઈ પાસે નથી.

તમે કહેશો કેમ એવું? એ નાના હતા ત્યારે



આપણે એમની ભાતભાતની ફરમાઈશ પૂર્ણ કરતા હતા ને? ત્યારે આપણી પાસે પણ સમય ન હતો, તો પણ એમની એક એક જરૂરિયાત પૂર્ણ કરતા હતા તે લોકો કેમ આપણી માટે ન કરે?

ન કરી શકે, કારણ કે એને પોતાનાં બાળકોની ફરમાઈશ પૂરી કરવાની હોય છે. તમારા સમયે તમે પણ તમારા માતા-પિતાની જરૂરિયાત અવગણીને બાળકોની જરૂરિયાતને જ મહત્વ આપ્યું હતું જ ને? આ તો સમયનું ચક્ર છે, જે ફર્યા જ કરે છે.

વયોવૃદ્ધ થવા સાથે મતિવૃદ્ધ પાછા થવું જોઈએ

‘વારા પછી વારો અને તારા પછી મારો’ એટલે જે આપણે આપણાં માતા-પિતા સાથે કર્યું તે જ આપણાં સંતાનો આપણી સાથે કરે છે. જરૂરિયાતો ઓછી હશે તો જીવન જીવવામાં સરળતા રહે છે.

વયોવૃદ્ધ થવા સાથે મતિવૃદ્ધ થવું જરૂરી છે. વયોવૃદ્ધ થતાં બુદ્ધિથી વિચારતા પણ શીખવું જોઈએ. આપણા કારણે કોઈને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જો વૃદ્ધો સંતાનોને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખશે તો સંતાનો પણ પોતાના વડીલોને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખશે. સંતાનો કાંઈ બુદ્ધ નથી, એમને પણ ખ્યાલ આવી જાય છે કે અમારાં માતા-પિતા અમને તકલીફ આપતા નથી તો અમારે પણ એમને કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. આ ગીવ એન્ડ ટેઈક રિલેશનશિપ જેવું છે. અરસપરસ છે.

વયોવૃદ્ધ થઈએ ત્યારે એક વસ્તુ ગાંઠે બાંધી લેવાની કે ‘મનનું ધાર્યું થાય તો ઠીક, ન થાય તો ઈશ્વરની ઈચ્છા...’ મનચાહી વસ્તુ મળે તો સારું. ન મળે તો વધારે સારું.

હવે તમે પૂછશો ન મળે તો વધારે સારું કેમ? જો એકવાર મન ચાહી વસ્તુ નહીં મળે અને તમે સમજી જશો કે હવે આ વસ્તુ નહીં મળે તેથી જો સમજી વિકસી હશે તો તમે બીજી વાર એની માગણી નહીં કરો તો એ વધારે સારું જ કહેવાયને?

જીવન સંઘ્યાએ જો સંઘ્યા-છાયાનો લાભ મેળવવો હોય તો ગુસ્સાને તિલાંજલિ આપી દેવાની. ગુસ્સો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને સંબંધો માટે તો ઓર હાનિકારક છે. એટલે ગુસ્સો તો કરવાનો જ નહીં. માથા પર બરફની કોથળી મૂડી હોય એટલી ઠંડક રાખવાની. જો તમે ગુસ્સો કરશો

તો સંતાનો પણ સામે ગુસ્સે થવાના જ છે. એ કાંઈ તમારી વાત સાંભળી લેવાના નથી. તો પછી શા માટે નકાર્યું થૂંક ઊડાડવાનું? તમારો ઓફિસમાં વટ હતો, તમારો પગલો બોલ ઘરમાં અને ઓફિસમાં ઝીલાતો હતો તે વાત ભૂલી જવાની, કારણ કે સમય બદલાઈ ગયો છે. હવે તમે કોઈને કામના રહ્યા નથી. તેથી વટ કી ઐસી તેસી કરી નાખવાની. તમે શાંતિથી જીવી શકો, બે ટાઈમ સારું ભોજન ખાઈ શકો, સાજે માંદે સંતાનો તમારી સંભાળ લે એટલું જ પૂરતું છે. એનાથી વધારે અપેક્ષા રાખવાની નહીં. ...મગજ શાંત રાખો. શાંતિથી જીવો અને શાંતિથી બીજાને જીવવા દો.

‘હમારે જમાને મેં તો...’ એ વાત તો કરતા જ નહીં. આવી વાતો આજ કરવાનો કોઈ અર્થ નથી. તમારો જમાનો અલગ હતો અને આ જમાનો અલગ છે. તેથી ભૂતકાળને વાગોળવો નહીં અને જો વાગોળવો જ હોય તો તમારા હમઉંઘ મિત્રો સાથે વાગોળવો, સંતાનો સામે હરગીઝ નહીં.

જો તમે પોતે શ્રીમંત હોય તો એનો રૂઆબ સંતાનો પર છાંટવો નહીં. પોતાની ધનસંપત્તિનું અભિમાન, વખાણ કરવા નહીં. સંતાનોને ધન સંપત્તિના રૂઆબમાં, વખાણમાં નહીં ધનસંપત્તિમાં રસ છે. તેથી રૂઆબ કરવાને બદલે સમયે સમયે સંતાનોને, પુત્રવધૂઓને, જમાઈઓને, પૌત્ર-પૌત્રીઓને ઈત્યાદિ સ્વજનોને ભેટ સોગાદ આપતા રહેવાની. એને કારણે એ બધા ખુશ રહેશે. વાતોથી નહીં વર્તનથી એમને ખુશી મળશે.

- તો, આજના લેખ માટે આટલું બધું પૂરતું છે, વધારાની વાત હવે પછી.....

ભાજપમાં હાઈ-વોલ્ટેજ ઊથલપાથલના સંકેત

રાજભવનમાં રોકાણ દરમિયાન વડા પ્રધાન મોદીએ ભાજપના નેતાઓ સાથે કરી ચર્ચા



મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુંબઈની મુલાકાતે છે. નરેન્દ્ર મોદીએ બુધવારે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. મુંબઈમાં ભૂગર્ભ મેટ્રો લાઇનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પછી, મુંબઈમાં ભાજપ છાવણીમાં મોટી અને હાઇ-વોલ્ટેજ ઊથલપાથલ થવાના સંકેતો મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમય પછી મુંબઈ આવ્યા છે. નજીકના ભવિષ્યમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની (જુઓ પાનું ૪) ►►

કાંદિવલીના ફ્લેટમાંના ‘ડબ્બા ટ્રેડિંગ’નો પર્દાફાશ: ત્રણ મહિનામાં ૬૧૫ કરોડનું ટર્નઓવર શેરદલાલ સહિત ત્રણ પક્કાયા

મુંબઈ: કાંદિવલી વિસ્તારમાં આવેલી ઇમારતમાંના ફ્લેટમાં ચાલતા ‘ડબ્બા ટ્રેડિંગ’નો મુંબઈ કાઝમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો અને આ પ્રકરણે ૪૮ વર્ષના શેરદલાલ સહિત ત્રણ જણાની ધરપકડ કરી હતી. ત્રણેય જણ પાસે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)નું કોઇ અધિકૃત લાઇસન્સ ન હોવા છતાં તેઓ એનએસઇ/એમસીએક્સ એક્સચેન્જ પર ગેરકાયદે ટ્રેડિંગ કરી રહ્યા હતા. શેરદલાલના કમ્પ્યુટરમાં (જુઓ પાનું ૪) ►►

‘ઝુંડ’ ફિલ્મના અભિનેતાની શસ્ત્રના ધા ઝીંકી હત્યા: મિત્રની ધરપકડ

નાગપુર: હિન્દી ફિલ્મ ‘ઝુંડ’માં ‘બાબુ છેત્રી’ના પાત્ર માટે પ્રખ્યાત થયેલા અભિનેતા પ્રિયાંશુ ઉર્ફે બાબુ રવિસિંહ છેત્રીની નાગપુરમાં દારૂ પીતી વખતે થયેલા ઝઘડા બાદ મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

બુધવારે વહેલી સવારે આ ઘટના બની હતી અને પોલીસે આરોપી ધ્રુવ લાલબહાદુર સાહુ (૨૦)ની ધરપકડ કરી હતી.

૨૧ વર્ષના અભિનેતા પ્રિયાંશુએ ૨૦૨૨ માં રિલીઝ થયેલી બિગ બી અમિતાભ બચ્ચન અભિનિત અને નાગરાજ મંજુળે દિગ્દર્શિત બાયોલોજિકલ સ્પોર્ટ્સ ફિલ્મમાં તેની ભૂમિકા માટે પ્રશંસા મેળવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રિયાંશુ છેત્રી અને આરોપી સાહુ નજીકના મિત્ર હતા અને તેઓ (જુઓ પાનું ૪) ►►

જોગેશ્વરીમાં સિમેન્ટ બ્લોક માથામાં વાગવાથી યુવતીનું મોત

મુંબઈ: જોગેશ્વરી વિસ્તારમાં નિર્માણધીન ઇમારતમાંથી પડેલો સિમેન્ટનો બ્લોક ત્યાંથી પસાર થઇ રહેલી યુવતીનાં માથામાં વાગતાં તેનું મૃત્યુ થયું હતું.

મૃતકની ઓળખ સંસ્કૃતિ અનિલ અમિન (૨૨) તરીકે થઇ હતી, જે જોગેશ્વરી પૂર્વમાં મજાસવાડી ખાતે કિરણદેવી દેવેન્દ્રસિંહ ચાલમાં પરિવાર સાથે રહેતી હતી.

સંસ્કૃતિ બુધવારે સવારના ૯.૩૦ વાગ્યે કામે જવા માટે ઘરેથી નીકળી હતી. સંસ્કૃતિ ઘરની નજીક રિઝેવલપમેન્ટ સાઇટ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે નિર્માણધીન ઇમારતમાંથી પડેલો સિમેન્ટ બ્લોક તેના માથામાં વાગ્યો હતો. સંસ્કૃતિના પિતા અનિલ ઉમેશ અમિને પોલીસને જણાવ્યું હતું કે હું સવારે (જુઓ પાનું ૪) ►►

પુણેમાં સ્કૂલ બસ સાથે મિની ટ્રક ટકરાતાં આઠ વિદ્યાર્થી ધાયલ

પુણે: પુણે-સોલાપુર હાઇવે પર સ્ટીલના સળિયા લઇ જતી મિની ટ્રક સ્કૂલ બસ સાથે ટકરાતાં આઠ વિદ્યાર્થી અને મહિલા એટેન્ડન્ટ ઘાયલ થયાં હતાં.

મિની ટ્રકમાંના સ્ટીલના અશુક સળિયા સ્કૂલ બસનો પાછળનો કાચ તોડીને અંદર ઘૂસી ગયા હતા. સદનસીબે એ સળિયા કોઇ વિદ્યાર્થીને વાગ્યા નહોતા.

પુણેમાં સોરતાપવાડી નજીક બુધવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. સ્કૂલ બસની સામે અચાનક (જુઓ પાનું ૪) ►►

PAC n DELIVER
INTERNATIONAL COURIER

Send parcels to your Children & loved ones in **CANADA, UK, USA & WORLD WIDE** including Garments, Farsan, Chocolates, Sweets, Gifts, Eatables, Medicines & any permissible item & get benefited with **SPECIAL rates.**
Contact : Mr. ANUJ SANGOI
8879991866
Email - sales@pacndeliver.com
"20 Yrs of Quality Service"

Real

BANDHANI

Patan & Rajkoti

PATOLA

OCTOBER - 2025

09th OCT

TO

12th OCT

THURSDAY

SUNDAY

Time : 10:00 am to 08:00 pm

RAJSHRUNGAR®

RAJKOT

AAKAR ART GALLERY

49A, Bhulabhai Desai Road, Breach Candy, Nr. Benzer, Mahalaxmi (W), Mumbai

9879187787





RAJSHRUNGAR RAJKOT

Print Master







સત્યમેવ જયતે
ગુજરાત સરકાર

ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ

ફ્લેગશીપ કાર્યક્રમ:

ઊર્જા આત્મનિર્ભરતા

વિકસિત ગુજરાત - વિકસિત ભારત @ ૨૦૪૭ તરફ અગ્રેસર

મુખ્ય અતિથિ

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

માનનીય મુખ્યમંત્રી, ગુજરાત

અતિથિ વિશેષ

શ્રી પ્રલ્હાદ જોશી

માનનીય કેન્દ્રીય મંત્રી, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય, ભારત

ગરિમામયી ઉપસ્થિતિ

શ્રી કનુભાઈ દેસાઈ

માનનીય મંત્રી નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ ગુજરાત

૬ ઓક્ટોબર ૨૦૨૫

બપોરે ૨:૦૦ વાગ્યાથી

ઉદ્ઘાટન સ્થળ - ગણપત યુનિવર્સિટી, મહેસાણા

કાર્યક્રમની રૂપરેખા: ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ

૯મી ઓક્ટોબર ૨૦૨૫, ગુરુવાર

- ઊર્જા આત્મનિર્ભરતા:** વિકસિત ગુજરાત - વિકસિત ભારત @ ૨૦૪૭ તરફ અગ્રેસર
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ:** પાવર અને એનર્જી ક્લસ્ટર
- ઓનશોર એન્ડ ઓફશોર વિકલ પાવર:** અનલોકિંગ અનટેપ્ડ પોટેન્શિયલ
- CEO સઉન્ડ ટેબલ:** બેઇનસ્ટોર્મીંગ ઓન કોર્પોરેશન - સુલિયર એનર્જી
- એક્સપ્લોરિંગ ઇમર્જિંગ ટેક્નોલોજીઝ:** હિયોથર્મલ, ટાઇડલ અને વેવ એનર્જી
- ગ્રીન સ્ટાર્ટઅપ્સ:** કાયરસાઇડ રેટ

૧૦મી ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર

- ગુજરાત:** એન આઇડિયલ હબ ફોર ગ્રીન હાઇડ્રોજન
- એક્સપ્લોરિંગ ઇમર્જિંગ ટેક્નોલોજીઝ:** ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ
- ફોમ ફોસિલ્સ ટુ ફ્યુચર્સ:** હાઇડ્રોકાર્બન ટ્રાન્ઝિશન અને બાયોએનર્જી ઇનોવેશનનું સંકુલન
- સિલિકન એન્ડ આર્મિ-ચોરસીપ ટુવર્ક્સ ઓ ગ્રીન ઇકોનોમી**
- RE ઇન્સિગ્રેશન:** સ્ટોરેજ સોલ્યુશન્સની નિર્ણાયક ભૂમિકા
- ક્લાયમેટ ફાઇનાન્સ ફોર એનર્જી ટ્રાન્ઝિશન**
- ઊર્જા વાર્તા ઓન મિશન ૫૦૦ GW:** નેટ ઝીરો તરફ પ્રયાણ
- કવોલિટી પાવર ટુ નેક્સ્ટ લેન ઇન્ડસ્ટ્રીઝ:** ગ્રીન ફીડર, ગ્રીન મેન્યુફેક્ચરિંગ, ગ્રીન ડેટા સેન્ટર, ગ્રીન ટેક્સટાઇલ અને સેમિકન્ડક્ટર્સ
- ડિઝાઇન ઇન્વેશન ઓફ ઇકોનોમી:** કૃષિ, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રમાં સૌર ઊર્જાનો ઉપયોગ - કાર્બન કેડિટના લાભ
- એનર્જી એફિશિયન્સી એન્ડ ઓડિટ:** સ્માર્ટ વપરાશ તરફ

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગુજરાત સરકાર